



Sr. No.	Recommendation	Response (Yes/No/NA)	Supporting Materials															
48	Define clear timelines for processing of application for conversion of land/ change in land use (from the date of application) for land outside of industrial parks/IDC areas.	Yes																
<a href="https://revenuedepartment.gujarat.gov.in/downloads/gr_01-07-08.pdf">https://revenuedepartment.gujarat.gov.in/downloads/gr_01-07-08.pdf</a>																		
<p style="text-align: center;"><b>જારીન મહેસૂલ સંદર્ભાની કબમ—ક્ષેત્ર અંતર્ગત બિનાયેતી પરવાનગીની કાર્યપદ્ધતિ.</b></p> <hr/> <p style="text-align: center;">ગુજરાત સરકાર, મહેસૂલ વિભાગ, કરાયક્રમાંક: જાપણ/૧૦૦૫/૪૨૪/૫ માનવબળ, ગાંધીનગર તારીખ: ૧-૭-૨૦૦૮</p> <p><b>વચાયે વાપણી:-</b></p> <p>(૧) મહેસૂલ વિભાગનો તા. ૧૦.૦.૮૦ નો કરાયક્રમાંક: જાપણ/૧૦૦૫/૨૦૯૪/૫</p> <p><b>પ્રસ્તાવના:</b></p> <p>ભેત્તી વિભાગ જારીનનો બિનાયેતી ઉપયોગ કરવા, તે અંગેની દંડનીય કાર્યવાહી કરવા અને રૂપાંતર કર નક્કી કરવા અંગેની જોગવાઈ જારીન મહેસૂલ સંદર્ભાની કબમ ક્ષેત્ર, ક્ષેત્રક, ક્ષેત્ર, ક્ષેત્ર ગાંધીનગર કરાયેબ છે. આ સંદર્ભી ભેત્તી વિભાગ હેતુ માટે પારસ્પર કરાયેબ જારીન આપવા તેના કોઈપણ ભાગનો ભેત્તી સિવાયના હેતુ માટે ઉપયોગ કરવા માટેની પરવાનગી ક્રેન્કટર/ જિલ્લા પંચાયત પાસેથી મેળવવાની જોગવાઈ કરવામાં આવેબ છે.</p> <p>બિનાયેતી પરવાનગી મેળવવાની કાર્યપદ્ધતિ વધુ જરૂરી અને સરળ બનાવવાના આશાયથી રાજ્ય સરકાર પુના વિચારપાઠાના અંતે આ સાથે જોડેલ પરિશીળન-૧ માં દર્શાવેલ પ્રવર્તનમાં કરાયોને ૨૬ કરી ઉપર આસુખમાં વંચાણી વીપેબ કરાયની જોગવાઈનો ચાલુ રાખી નાચે ગુજરાતની કાર્યપદ્ધતિ અનુસરવાનું કરાયે છે.</p> <p><b>કરાયક્રમ:</b></p> <p>૧. બિનાયેતી પરવાનગી આપવા માટે તથા તે અંગેની દંડનીય કાર્યવાહી કરવાની, બિનાયેતી આકાર તથા રૂપાંતર કર નક્કી કરવાની સરથી સત્તાનો :</p> <table border="1"> <thead> <tr> <th>ક્રમ</th> <th>સરથી અપિકારી</th> <th>આપરી વૈબાધેબ વિસ્તાર</th> </tr> </thead> <tbody> <tr> <td>(ક)</td> <td>ક્રેન્કટર</td> <td>મહાનગરપાલિકા વિસ્તાર, શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ, વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નોરીકાઈડ જોરીયા અને કેન્ટોન્મેન્ટ જોરીયામાં સમાવિષ્ટ થતો વિસ્તાર તથા 'એ' તથા 'બી' કાલાની નગરપાલિકાઓ.</td> </tr> <tr> <td>(ખ)</td> <td>પ્રાન્ત અપિકારી</td> <td>'સી' તથા 'ડી' કાલાની નગરપાલિકાઓ.</td> </tr> <tr> <td>(ગ)</td> <td>તાલુકા પંચાયત</td> <td>શિલ્વા વસ્તી જલાલી ગુજરાત રાજ્યના પાંચ લજારથી અંગેની વસ્તી પરાવત્તા ગામોમાં અને ૨(બે) એકર સુધીની જગ્યાન ગર્યાછું.</td> </tr> <tr> <td>(ઘ)</td> <td>જિલ્લા પંચાયત</td> <td>ઉપર પારા (ક) (ખ) અને (ગ) માં સમાવિષ્ટ ન વધેબ આપ્ય વિસ્તાર.</td> </tr> </tbody> </table>	ક્રમ	સરથી અપિકારી	આપરી વૈબાધેબ વિસ્તાર	(ક)	ક્રેન્કટર	મહાનગરપાલિકા વિસ્તાર, શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ, વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નોરીકાઈડ જોરીયા અને કેન્ટોન્મેન્ટ જોરીયામાં સમાવિષ્ટ થતો વિસ્તાર તથા 'એ' તથા 'બી' કાલાની નગરપાલિકાઓ.	(ખ)	પ્રાન્ત અપિકારી	'સી' તથા 'ડી' કાલાની નગરપાલિકાઓ.	(ગ)	તાલુકા પંચાયત	શિલ્વા વસ્તી જલાલી ગુજરાત રાજ્યના પાંચ લજારથી અંગેની વસ્તી પરાવત્તા ગામોમાં અને ૨(બે) એકર સુધીની જગ્યાન ગર્યાછું.	(ઘ)	જિલ્લા પંચાયત	ઉપર પારા (ક) (ખ) અને (ગ) માં સમાવિષ્ટ ન વધેબ આપ્ય વિસ્તાર.			
ક્રમ	સરથી અપિકારી	આપરી વૈબાધેબ વિસ્તાર																
(ક)	ક્રેન્કટર	મહાનગરપાલિકા વિસ્તાર, શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ, વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નોરીકાઈડ જોરીયા અને કેન્ટોન્મેન્ટ જોરીયામાં સમાવિષ્ટ થતો વિસ્તાર તથા 'એ' તથા 'બી' કાલાની નગરપાલિકાઓ.																
(ખ)	પ્રાન્ત અપિકારી	'સી' તથા 'ડી' કાલાની નગરપાલિકાઓ.																
(ગ)	તાલુકા પંચાયત	શિલ્વા વસ્તી જલાલી ગુજરાત રાજ્યના પાંચ લજારથી અંગેની વસ્તી પરાવત્તા ગામોમાં અને ૨(બે) એકર સુધીની જગ્યાન ગર્યાછું.																
(ઘ)	જિલ્લા પંચાયત	ઉપર પારા (ક) (ખ) અને (ગ) માં સમાવિષ્ટ ન વધેબ આપ્ય વિસ્તાર.																



૨. બિનાયેતી પરવાનગી માટેની અરજી કરવાની પણતિ :

- (ક) જગ્યાન મહેસૂલ સંદર્ભાન્તા ૧૯૦૮ ની કલમ-૫૪ હેઠળ બિનાયેતી પરવાનગી મેળવવા માટેની અરજી જગ્યાનનો કાપદેશરનો પારસ કરનાર/ ખાતેદાર (OCCUPANT) જ કરી શકશે. અભજદાર એકથી વધુ હોય તો તમામ અભજદારે સંયુક્ત સહીશી અરજી કરવાની રહેશે.
- (ન) અરજદારે નિયત નયુના (પરિશીષ્ટ-૨) માં બિનાયેતી પરવાનગી મેળવવા માટેની અરજી ઉ (ત્રસ) નકલમાં કરવાની રહેશે.
- (ગ) બિનાયેતી પરવાનગી માટેની અરજી સાથે પરિશીષ્ટ-૩ માં દર્શાવાયેલ પુરાવા રજુ કરવા કરજીયાંત રહેશે.

ઉપર મુજબની કાર્યપણતિ ક્રેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાન્ત અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને અરજી કરતી વાતો અનુસરવાની રહેશે. આ પુરાવાઓ તથા પણતિ સિવાય અરજી સ્વીકારવાપાત્ર બનશે નહીં.

૩. જગ્યાન મહેસૂલ સંદિતાની કલમ-૫૪ હેઠળ કરાયેલ બિનાયેતી પરવાનગી માટેની અરજી પણતી સહમ અધિકારી/કચેરીએ કરવાની છીણ કાર્યવાહી :

- (ક) બિનાયેતી પરવાનગી માટેની અરજી પણતી સહમ અધિકારીએ આ સાથેના પરિશીષ્ટ-૩ મુજબના પુરાવાઓની ચકાસણી કરી જો અરજી સ્વીકારવાપાત્ર હોય અને અરજદારે રૂખુ આપેલ હોય તો આવી અરજીની પણોચ રૂખુમાં અરજદારને તુરત જ પાકવાની રહેશે અને જો અરજી ટપાવ મારફતે મળી હોય તો ઇન-૩ માં અરજદારને પહોંચ પાકવાની રહેશે.
- (ન) જગ્યાન મહેસૂલ સંદિતાની કલમ-૫૪ ની જોગવાઈ અન્યાં બિનાયેતી પરવાનગી માટેની અરજી અંગે સહમ અધિકારી/સત્તાએ પોતાના નિર્દ્ય અંગેની જાણ ત્રસ માસની વૈધાનિક સમય મર્યાદામાં અરજદારને કરવાની રહેશે. અચ્યતિ ત્રસ માસની સમય મર્યાદા પૂર્વ થતો અરજદારને ચોક્કસ આપાર સાથેનો પત્ર/પ્રમાણપત્ર, મંજૂરી પત્ર કે નાનાંજૂરીપત્ર આપવાનો રહેશે.
- (ગ) હાલ સહમ સત્તાએ બિનાયેતી પરવાનગી આપવા માટે જુદા જુદા ૧૨(બાર) જિટબા વિવિષ ખાત્પદ્ધરીના 'ના વાંચા પ્રમાણપત્ર' મેળવ્યા બાદ બિનાયેતી પરવાનગી આપવાનો નિર્ધય કરે છે તેને બદલે હવેથી માત્ર જગ્યાન મહેસૂલ સંદિતા તેમજ જગ્યાન મહેસૂલ નિયમોની જોગવાઈઓને આપિન નીચેના મુદ્દાઓ અંગે માત્ર ક્રેક્ટર કચેરી પાસેથી જ અભિપ્રાય મેળવી રેનો નિર્ધય કરશે, અન્ય કચેરીઓ/ ખાતાઓના અભિપ્રાય બાબતે પરિશીષ્ટ-૫ માંની કલમ (૧૮) મુજબની નોટીસ આપી તે મુજબની કાર્યવાહી સહમ સત્તાએ અનુસરવાની રહેશે.



ક્વેક્ટર ક્રેડિટ નીચે જાપાને બાજુનો અભિપ્રાય દિન-૨૧ માં  
આપવાનો રહેશે.

- ❖ પ્રશ્ન દેખણની જરૂરના ગાંધીજી લક્ષ્યપાસા (ગાઈટબ) બાબતે ના વાંચા  
પ્રમાણપત્ર આપવાની જવાબદારી મહેસૂલી સલાહિકારી હેચા કે ક્વેક્ટર,  
નાયા ક્વેક્ટર, પ્રાન અધિકારીની રહેશે.
- ❖ પ્રશ્ન દેખણની જરૂરની શરતની ગણોત્તપારા કે અન્ય કોઈ કાયદા મુજબ  
પ્રતિબંધિત સાથી પ્રકારની છે કે કેમ? જો છા, તો પ્રશ્ન દેખણની જરૂરનો  
નિનાખેતીના દેતું માટે ઉપયોગ કરવા માટેની ક્વેક્ટરશીની મંજૂરીનો મુકમ  
કરવામાં આવેલ છે કે કેમ? ક્વેક્ટરશી બારા નક્કી કરવામાં આવેલ  
ઉપયોગની રકમ જના કરાવવામાં આવેલ છે કે કેમ?
- ❖ પ્રશ્ન દેખણની જરૂરન સંપાદન દેખણ છે?
- ❖ પ્રશ્ન દેખણની જરૂર શહેરી જરૂર ટોચ મર્યાદા પાર દેખણ સરકારમાં  
સંપ્રાપ્ત થયેલ છે કે કેમ?
- ❖ પ્રશ્ન દેખણની જરૂરના ગાંધીજીપાસા અંગે કેમ, વિવાદ કે અપીલના મુહૂ  
કોઈ કાર્યવાહી ચાલુ છે કે કેમ?
- ❖ પ્રશ્ન દેખણની જરૂરનમાં કોઈ સરકારી વેણું વસ્તુવ વેવાનું બાકી છે કે કેમ?

જો નિર્દિષ્ટ કરેલ અમય મર્યાદામાં ક્વેક્ટર ક્રેડિટ તેમનો અભિપ્રાય નહીં  
આપે તો તેઓએ કોઈ અભિપ્રાય આપવાનો રહેતો નથી તેમ માની સંગમ સત્તાએ  
આગળનો નિર્ધિય વેવાનો રહેશે.

- (૫) એ કેસમાં નિનાખેતી પરવાનગી આપવાની સલાહ ક્વેક્ટરશીની છે ત્યાં ઉપર મુજબના  
મુદ્દાની ચકાસહી ક્વેક્ટરશીએ આંતરિક વ્યવસ્થાથી દિન-૨૧ માં કરી વેવાની  
રહેશે. ઉપરાંત જ્યાં સંગમ અધિકારી તરીકે પથપ્રસંગે મહેસૂલ વિભાગ તરફથી  
જિલ્લા ક્વેક્ટર કે પંચાયત વિભાગ તરફથી જિલ્લા વિકાસ અધિકારીએ વેન્ક રેવન્યુ  
કોડ કે વેન્ક રેવન્યુ રૂલ્સ નીચે એ બાબતો તપાસવાની છે અને જ્યાં વાંચો નથી તેના  
મંજૂરી મુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. ઉપરાંત રાજ્ય સરકાર સિવાયના  
સલાહિકારીઓ જેન કે રેલ્વે, ઠિકાદીશીરી કંપની, મેરોક્રાસ, ભારતીય વાયુસેના,  
બો.એન.જી.સી., કેન્દ્ર સરકારના કાયદા નીચે રહિત સ્પારક થોપિટ ઠિનારત માટે  
કેન્દ્રીય મુરાતાલ્ય ખાતુ, રહિત વન અભ્યારહ્ય કે રાષ્ટ્રીય ઉપવન માટેની સંગમ  
સત્તાને ઉપર મુજબ પરિશિષ્ટ-૫ ની કલમ ૧૮(૫) મુજબ ૨૧ દિવસમાં હકારાત્મક  
જવાબ આવી જાય તો તેનો મંજૂરી મુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. (નેથી  
નિનાખેતી પરવાનગી બાદ આવા અરજારારોને બાકી રહેતા સંગમ અધિકારીઓ પેકી

કોણી ગંજુરી બાકી છે અથવા તો તેના બાંધકામમાં આવી સત્તાઓના કોઈ નિયંત્રણો નાકા નથી તેની ખાતી થઈ શકે.)

- (૪) જે કેસમાં બિનાંભેતી પરવાનગી આપવાની સત્તા હિલ્વા વિકાસ અપિકારીશી/પ્રાન્ત અપિકારીશી/તાવુક વિકાસ અપિકારીશીને છે ત્યાં અરજી મળ્યેથી ટેન-૧૦માં અરજીની ચકાસલી કરીને ક્વેક્ટર ક્રેનીને પ્રકરણ મોકલી ઉપર મુજબના અભિપ્રાયો મેળવવાની કાર્યવાહી કર્યો, ક્વેક્ટરશીનો અભિપ્રાય મળ્યા બાદ સથાન સત્તાને સમય મર્યાદાના બિનાંભેતી પરવાનગી અંગેનો નિર્ણય કરવાનો રહેશે.
- (૫) જે વિલારમાં ટાઇન ખાનિગ એકટની જોગવાઈ ડેણ ટી.પી.સી.મ શરીનલ થઈ ગયેલ હોય અને શરીનલ ખોટ જાહેર કરવામાં આવ્યા હોય ત્યાં ખાન ગંજુર કરનાર સથાન અપિકારી બાબા જે અભિપ્રાયોની ચકાસલી કરવામાં આવતી હોય તે ક્રેનીના અભિપ્રાયો ક્વેક્ટરે મંગાવવાની જરૂર નથી. ક્વેક્ટરે માત્ર જાળીના ટાઈટલ્સ, નવી શરૂ/પ્રતિબંધિત સત્તાપ્રકારની જાળીનાં પ્રશિયમ વસ્તુલાલ તથા વસ્તુલ કરવાપાત્ર દુષ્પાંતર વેરા અને બિનાંભેતી આકાર નક્કી કરી આપવા અંગેની કાર્યવાહી કરવાનો રહેશે.

#### **૪ હિલ્વા વિકાસ અપિકારીશી/તાવુક વિકાસ અપિકારીશીએ અનુસરવાની કાર્યપદ્ધતિ:**

- (ક) હિલ્વા વિકાસ અપિકારીશી / તાવુક વિકાસ અપિકારીશીએ બિનાંભેતી પરવાનગીના કેસની સમગ્ર ચકાસલી કરી ક્વેક્ટર ક્રેનીનો અભિપ્રાય મેળવી પોતાના અભિપ્રાય સાથે કેસ હિલ્વા/તાવુક પંચાયતની તે માટેની સથાન સત્તા સમગ્ર સમયસર રજૂ કરવાનો રહેશે.
- (ન) જગ્નિન મહેસૂલ સંહિતાની ક્વમ-૧૫ ની જોગવાઈ અનુસાર કોઈપણ અરજી નંંગે ત્રણ માસની વૈધાનિક સમય મર્યાદામાં નિર્ણય વેવાનો રહેતો હોયથી હિલ્વા/તાવુક પંચાયતની સથાન સત્તા કોઈપણ કારણસર આવી અરજી ઉપર ત્રણ માસની વૈધાનિક સમય મર્યાદામાં નિર્ણય ન કરે તો તેવા કિસ્યામાં હિલ્વા વિકાસ અપિકારી/તાવુક વિકાસ અપિકારીશી જાળીન મહેસૂલ સંહિતાની ક્વમ-૧૫ ની જોગવાઈ અનુસાર અરજાદારને આપોઆપ બિનાંભેતીની પરવાનગી મળ્યા અંગેની જાણ કરશે.
- ૫. બિનાંભેતી પરવાનગી આપતી સથાન સત્તાએ પરિવ્રેષ્ટ-૫ માં સુચચ્ચા મુજબની ગર્વદશીક સૂચનાઓનું ચુક્સાપણે પાવન કરવાનું રહેશે.
- ૬. દાદ રાજ્યના તમામ વિસ્તારો માટે બિનાંભેતી પરવાનગી આપવાની વૈધાનિક સમય મર્યાદા મહત્તમ ત્રણ માસની નક્કી કરવામાં આવેલ છે તેમ છતાં કાર્યપદ્ધતિએ ઉપરની વિગતે દાદના આવેલ સરળીકરણ અને બિનાંભેતી પરવાનગીના કષમાં જરૂર



(ક) સમગ્ર રાજ્યમાં રહેશેંકના હેતુ માટે બિનાનેતી પરવાનગી આપવા માટે  
વધુમાં વધુ સમય મર્યાદા ડૉ ડિવસની.

(ખ) સમગ્ર રાજ્યમાં અન્ય હેતુ માટે બિનાનેતી પરવાનગી આપવા માટે  
વધુમાં વધુ સમય મર્યાદા ડૉ ડિવસની.

આ અંગે વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ઉપરોક્ત (ક) અને (ખ) એક  
વરીવટી સૂચના લોઈ આવી બિનાનેતી ઉપયોગની અરજીઓનો કોઈ ડિવસમાં ઉપર  
દર્શિત સમય મર્યાદામાં નિકાલ કરવો શક્ય ન જણો તો તેવા ડિવસમાં બિનાનેતી પરવાનગી  
આપોઅપ મળી ગયેલી જણાડી નથી.

૫. નકશા મંજૂર કરનાર સલામ અપિક્રાશી બિનાનેતીની પરવાનગી રિના નકશા મંજૂર કરી  
શકો, પરંતુ બિનાનેતી પરવાનગી વગર આવા બાંંકામની રજાચિહ્ની આપી શકો નથી.
૬. બિનાનેતી પરવાનગી આપનાર દરેક સલામ સલામો બિનાનેતી પરવાનગી આપતા હુકમની  
માથે પરિણિષ્ટ-૪ અભૂકૃપણે જોડવાનું રહેશે અને અરજદારને પરિણિષ્ટ-૪ ની શરતોને  
આપિન આ મંજૂરી આપવામાં આવે છે તેનું સ્પષ્ટપણે જણાવવાનું રહેશે, તેમજ તેમાં  
ઉદ્વેભાવેથ શરતોનું પાબન અરજદારે કરવાનું રહેશે તે મતવાનનો સ્પષ્ટ ઉદ્વેભ હુકમની  
અંદર કરવાનો રહેશે, અને અરજદાર તેમાંની કોઈપણ શરતનો બંગ કરશે તો તેની સાથે  
શરતલાંગની કર્યાવાહી કરવામાં આવશે તેનું પણ જણાવવાનું રહેશે.
૭. ઉપર મુજબની જોગવાઈનો તમામ સલામ સલામીકારીઓના ચ્યાન ઉપર વાલીને આ  
જોગવાઈનોનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

ગુજરાતના રાજ્યપાદક્ષીના હુકમથી અને તેમના નામે,

(અસ.અસ. જોથી)

બિડાલ:- પરિણિષ્ટ-૧ થી ૫

સરકારના ઉપ સચિવ  
મહેસૂલ વિભાગ

#### નકશ રવાના

- ❖ માન. રાજ્યપાદક્ષીના સચિવશી, રાજ્યબન, ગાંધીનગર (એજ વ્યાર)
- ❖ માન. મુખ્યમંત્રીશીઠીના અગ્રસચિવશી, સચિવાદ્ય, ગાંધીનગર.
- ❖ માન. મંત્રીશી (મહેસૂલ) ના અંગત સચિવશી, સચિવાદ્ય, ગાંધીનગર.
- ❖ તમામ માન. મંત્રીશીઓના અંગત સચિવશી, સચિવાદ્ય, ગાંધીનગર.
- ❖ તમામ માન. રાજ્યકાશાના મંત્રીશીઓના અંગત સચિવશી, સચિવાદ્ય, ગાંધીનગર.
- ❖ મુખ્ય સચિવશીના નાયા વિભાગ, સચિવાદ્ય, ગાંધીનગર.
- ❖ અગ્રસચિવશી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિગમા વિભાગ, સચિવાદ્ય, ગાંધીનગર.
- ❖ અગ્ર સચિવશી, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાદ્ય.

Timeline for Change  
of Land Use for  
Industrial Purpose

